

પ્રકરણ-૯

વિકાસશાખાના સ્ટાફની માહિતી

ક્રમ	વિગત	વર્ગ	ભરેલ	ખાલી
૧	નાયબ જિલ્લા વિકાસ અધિકારી	૧	૦	૧
૨	નાયબચીટનીસ	૩	૨	૦
૩	જુનિયર ક્લાર્ક	૩	૩	૪
૪	ડ્રાઈવર	૩	૧	૦
૫	પટાવાળા	૪	૧	૧

વિકાસ કાર્યક્રમ

સરકારશ્રી તરફથી જિલ્લા પંચાયતને તબદીલ થયેલ યોજનાઓની અમલવારી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે. સરકારશ્રી તરફથી આવતાં અનુદાનોની ફાળવણી અને તેના ખર્ચ પર નિયંત્રણ તેમજ ફાળવેલ રકમના હિસાબો ઉપર દેખરેખ તેમજ યોજનાની નાણાકીય અને ભૌતિક સિદ્ધિ હાંસલ થાય તે માટે યોજનાઓના અમલીકરણને વખતોવખત મોનીટરીંગ કરવામાં આવે છે.

સરદાર પટેલ આવાસ યોજના

ભૂમિહીન ખેત-મજુરો ગ્રામ્ય કારીગરો વસવાટ કરવા માટે ધરથાળ પ્લોટની ફાળવણી કરવાની યોજના ૧૯૭૨થી અમલમાં છે. તેમજ આ ફાળવેલ પ્લોટો પર મકાન બાંધકામ માટે સહાય આપવાની યોજના સને ૧૯૭૬થી અમલમાં હતી. આ યોજના અન્વયે સરદાર પટેલ આવાસ યોજના તા. ૧/૪/૧૯૮૭થી અમલમાં છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ૧૦૦ ચો.વાર મફત પ્લોટ તથા ૪૫૦૦૦ની કીમતનું મકાન અરજદાર પોતાના મારફતે અથવા સ્વૈચ્છિક સંસ્થા મારફતે બનાવીને લાભાર્થી આપવાની યોજના અમલમાં છે તેમજ સરદાર આવાસ યોજના-૨ વર્ષ: ૨૦૧૪-૧૫ થી ૨૦૧૫-૧૬ અમલમાં હતી. જેમાં બી.પી.એલ. સિવાયના લાભાર્થીઓ માટે ૪૦,૦૦૦/- ની મકાન સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી હતી. વર્ષ : ૨૦૧૭ દરમ્યાન આવાસ યોજના લક્ષ્યાંક ૦ આપવામાં આવેલ પરંતુ સ્પીલ ઓવર કામો પૈકી માર્ચ ૧૮ અંતિત ૧૬૫ કામો પુરા થયેલ છે અને ૪૬૯ કામો પ્રગતિ હેઠળ છે. તેમજ પાત્રતા ધરવતા લાભાર્થીઓને ૫૮ સો ચો.વાર મફત પ્લોટ આપવામાં આવેલ છે.

એચ.એસ.જી.-૩

ગ્રામીણ આવાસ યોજના અન્વયે સંપાદન અને માળખાકીય સુવિધાના કામો પૈકી માળખાકીય સુવિધાના કામોમાં રાજ્ય સરકારશ્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામીણ કક્ષાએ આવાસ યોજના હેઠળ સરદાર આવાસ યોજના તથા ૧૦૦ ચો.વાર પ્લોટ વિસ્તાર અને ઈન્દિરા આવાસ યોજના વસાહતોમાં ૧૫ કરતાં વધારે કુટુંબો વસવાટ કરતાં હોય તેઓને પાયાની સુવિધા મળી શકે તે માટે સી.સી.રોડ, પીવાના પાણીની પાઈપલાઈન, ગટર, સ્ટ્રીટ લાઈટ વીજળીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવા સારૂ ઉક્ત એચ.એસ.બી.-૩ યોજના સને ૨૦૦૬-૦૭ના વર્ષમાં અમલમાં મૂકેલ છે.

જે અન્વયે કચ્છ જિલ્લાને સને ૨૦૧૭-૧૮નાં વર્ષમાં માળખાકીય સુવિધામાં કામો માટે લક્ષ્યાંક ફાળવવામાં આવેલ નથી.

એચ.એસ.જી.-૪ જમીન પ્લોટ વિકાસ

આ યોજના હેઠળ સરદાર આવાસ યોજના તથા ઈન્દિરા આવાસ યોજના હેઠળના લાભાર્થીઓના જમીન માટેના પ્લોટ વિકાસ માટે સને ૨૦૧૭-૧૮નાં વર્ષમાં ભૌતિક લક્ષ્યાંક લાભાર્થી દીઠ મહત્તમ રૂ. ૧૦૦૦ નો વિકાસ ખર્ચ યોજનામાં ૦ લાભાર્થી સામે ૦ લાભાર્થી આવરી લીધેલ છે. નાણાકીય લક્ષ્યાંક રૂ....૦...લાખના સામે રૂ....૦....લાખનો ખર્ચ થયેલ છે.

૧૪મુંનાણાપંચ

આ યોજના ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકાયેલ છે. જે ગુજરાત સરકારશ્રી તરફથી ૧૪ માં નાણાપંચની ભલામણ અનુસાર પંચાયતો માટે નાણાકીય આવકના સાધનો સંગીન બનાવવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને આર્થિક સહાય આપવા સને ૨૦૧૫-૧૬થી ૨૦૧૮-૨૦ સુધી પાંચ વર્ષ માટે અમલમાં મૂકેલ છે. આ યોજનામાં ગ્રાન્ટ ભારત સરકારશ્રી દ્વારા રાજ્ય સરકારશ્રીને ફાળવવામાં આવે છે. સરકારશ્રી તરફથી દર વર્ષે ગ્રાન્ટ ફાળવણી. જે ૧૦૦% ગ્રાન્ટ વખતસર રચાયેલ ગ્રામ પંચાયતને ફાળવવાની જોગવાઈ થયેલ છે. અને નિયમ મુજબ ગ્રામ્ય કક્ષાએ વિકાસ કામો હાથ ધરવાના હોય છે. આમ ૧૪માં નાણાપંચના અનુદાનની ફાળવણી, તેના ખર્ચ ઉપર નિયંત્રણ, ફાળવેલ રકમોના હિસાબો ઉપર દેખરેખ તેમજ યોજનાની સિદ્ધિ હાંસલ થાય તે માટે વખતો વખત ભૌતિક અને નાણાકીય મોનીટરીંગ કરવામાં આવે છે.

(૧) ૧૪ માં નાણાપંચમાં વર્ષ : ૨૦૧૫-૧૬માં રૂ.૩૮૬૮.૨૬ લાખની ગ્રાન્ટ ફાળવણી સામે માસ માર્ચ ૧૮ અંતિત કુલ ૨૦૧૩ કામો પૂર્ણ થયેલ છે. અને ખર્ચ રૂ. ૩૩૩૮.૮૪ લાખનો થયેલ છે.

(૨) ૧૪માં નાણાપંચમાં વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૬૪૮૪.૨૮ લાખની ગ્રાન્ટ ફાળવણી સામે માસ માર્ચ ૧૮ અંતિત કુલ ૨૧૨૦ કામ પૂર્ણ થયેલ છે. અને ખર્ચ રૂ.૩૮૧૫.૦૮ લાખનો ખર્ચ થયેલ છે.

(૩) ૧૪માં નાણાપંચમાં વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૭૨૮૮.૮૭ લાખની ગ્રાન્ટ ફાળવણી સામે માસ માર્ચ ૧૮ અંતિત કુલ ૭૬૮ કામ પૂર્ણ થયેલ છે. અને ખર્ચ રૂ.૧૪૪૦.૬૩ લાખનો ખર્ચ થયેલ છે.

પંચવટી યોજના

ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય પ્રજાની સુખાકારી, આનંદ પ્રમોદ માટે સુવિધા યુક્ત બાગ બગીચાને પ્રોત્સાહન આપતી અને તે યોજના તળે પારંપરિક વૃક્ષોનાં વાવેતર દ્વારા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ રહે તે હેતુસર વર્ષ : ૨૦૦૪-૦૫થી આ યોજના અમલમાં આવેલ છે. તે સમયથી ગ્રામ પંચાયત લોકફાળા પેટે રૂ.૫૦૦૦૦/- ભરે અને સરકારશ્રી તરફથી રૂ.૧૦૦૦૦૦/- ગ્રાન્ટ ફાળવણી થઈ રૂ.૧૫૦૦૦૦/- આ યોજના પેટે જોગવાઈ રહેલી છે.

માં. ઉપસચિવશ્રી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ના તા. ૧૧-૦૮-૨૦૦૪ વાળા ઠરાવથી બાઉન્ડ્રી, શુશોભિત પ્રવેશદ્વાર, બાંકડા બાળકો માટે મનોરંજનનાં સાધનો અને રમતગમતનાં સાધનો, શૌચાલય બાથરૂમની સગવડ સાથે, (મહિલાઓ માટે અલાયદી વ્યવસ્થા સાથે) વૃક્ષોનું વાવેતર, વીજળી વ્યવસ્થા કરવાની રહેશે.

ગ્રામ પંચાયત દ્વારા લોકાફાળો નહિ ભરી શકતા અને હાલનાં ભાવ વધારો પ્રમાણે રૂ.૫૦૦૦૦૦/- સરકારશ્રી દ્વારા જ ફાળવવાની જોગવાઈ કરવામાં આવે અને ગ્રામ પંચાયતનો લોકાફાળો કે અન્ય ડોનેશન લેવાનાં ન રહે તો સરકારશ્રીએ ફાળવેલ લક્ષ્યાંક સિદ્ધ કરવા સરળતાથી કાર્યવાહી થઈ શકે તેવું માનવું છે.

આ યોજનાનાં લક્ષ્યાંક સામે વર્ષ : ૨૦૧૭-૧૮ની સિદ્ધિ નીચે મુજબ છે.

લક્ષ્યાંક		સિધ્ધિ	
ભૌતિક	નાણાકીય	ભૌતિક	નાણાકીય
૧૧	૧૧.૦૦	૨	૨.૦૦